

04 ઓક્ટોબર 2018

શું એવું માનો છો કે મતદાનથી કોઈ ફરક નથી પડતો? ફરી વિચારો.

બ્રમ્પટન, ઓન્ટારિયો – માર્ગો, બગીચા, જાહેર પરિવહન, કટોકટીની સેવાઓ, મનોરંજન, પુસ્તકાલયો... જો આ પૈકી કોઈ એકાદ સેવાનું પણ આપને માટે મહત્ત્વ હોય તો અપનો મત કીંમતી છે. આ એક નવા રસપ્રદ વિડિયોનો મુખ્ય સંદેશ છે, [“તે કીંમતી છે. તમે કીંમતી છો.”](#) જે સીટી ઓફ બ્રમ્પટન દ્વારા જારી કરવામાં આવ્યો છે, જે લાયકાત ધરાવતા મતદાતાઓને 22 ઓક્ટોબર 2018ના દિને મ્યુનિસિપલ ચૂંટણીમાં બહાર આવીને મતદાન કરવાની અરજ કરે છે.

"લોકોને તેમની સીટીની સેવાઓ અને પ્રોગ્રામ્સ સાથે પોતે કેટલા બધાં સંકળાયેલા છે તેની કલ્પના જ નહીં હોય. મતદાન એટલે પોતાના સ્થાનિક પ્રશાસનમાં પોતાનો અવાજ બુલંદ કરવાની પ્રભાવશાળી રીત છે," એવું બ્રમ્પટન મ્યુનિસિપલ ચૂંટણીના સીટી ક્લર્ક અને નિર્વાચન અધિકારી, પીટર ફે એ જણાવ્યું હતું. ગત વર્ષે વરિષ્ઠ નાગરિકોએ ઉપયોગમાં લીધેલ કેટલીક સીટી સેવાઓ અને પ્રોગ્રામ્સમાં 1.2 મિલિયન સવારીઓ, યુવાનો દ્વારા 3.4 મિલિયન સવારીઓનો સમાવેશ થાય છે; બાળકોના રિક્રિએશન પ્રોગ્રામ્સમાં 1,24,900 રજિસ્ટ્રેશનો થયા; બ્રમ્પટનની લાઈબ્રેરીમાંથી 4 મિલિયન આઈટીઓની લેવામાં આવી; અને બ્રમ્પટનની આગ અને અગ્નિશમન સેવાઓ દ્વારા 24,320 કટોકટીના કૉલ પર કામગીરી કરવામાં આવી હતી.

"જ્યારે આપ આપના મેયર, કાઉન્સિલર અને સ્કૂલ બોર્ડના ટ્રસ્ટીને મત આપો છો ત્યારે આપ તેમને તમારે માટે જે અતિમહત્ત્વપૂર્ણ રોજિંદી બાબતો છે તે વિષયક નિર્ણયો લેવાની જવાબદારી સોંપો છો. તેથી તમારે મત આપવો જોઈએ," એવું ફે એ ઉમેર્યું હતું.

ડેટા દર્શાવે છે કે અન્ય વય જૂથોની સરખામણીએ યુવા મરદાતાઓની ઉપસ્થિતિ સૌથી નિમ્ન, એટલેકે 21 ટકાની આસપાસ રહી છે. આ વિશે વધુ માહિતી આ [ડેટા સ્ટોરી](#)માં ઉપલબ્ધ છે.

જ્યારે કે અગાઉ મતદાતાઓને મત આપવા માટે નિયત સ્થળે મત આપવા જણાવાયું હતું, આ વખતની ચૂંટણીમાં સીટી ઓફ બ્રમ્પટન દ્વારા "તમારા વોર્ડમાં કોઈ પણ જગ્યાએ મત આપો" શરૂ કરવામાં આવ્યું છે", જે લોકોને તેઓ નિવાસ કરતા હોય તે વોર્ડ પૈકી 10-15 મત આપવાના સ્થળોનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સીટી વેબસાઈટ પર [ઈન્ટરએક્ટિવ નક્શો](#) તમને મત આપવાનું તમારું પસંદગીનું સ્થળ શોધવામાં મદદ કરશે. "તમે કોઈ નાના મોટા કામ માટે નીકળો, કામ, અભ્યાસ અથવા ઉપાસના માટે આવતા જતાં થોડો સમય આપીને મતદાન કરશો. આનાથી બ્રમ્પટનના ભવિષ્યને આકાર આપવામાં ખૂબ મોટી મદદ મળશે" એવું ફે એ ઉમેર્યું હતું.

જે લોકોને મતદાન વહેલું કરવાની ઈચ્છા હોય તેઓ એડવાન્સ વોટિંગની નીચેની તારીખોએ તેમ કરી શકશે:

શનિવાર, ઓક્ટોબર 6, અને શનિવાર, ઓક્ટોબર 13, સવારે 10 થી સાંજે 5

- બ્રમ્પટન સીટી હોલ, 2 વેલિંગ્ટન સ્ટ્રીટ પશ્ચિમ
(Brampton City Hall, 2 Wellington St W)
- બ્રમ્પટન સોકર સેન્ટર, 1495, સેન્ડલવુડ પાર્કવે પૂર્વ
(Brampton Soccer Centre, 1495 Sandalwood Pkwy E)
- કેસી કેમ્પબેલ કમ્યુનિટી સેન્ટર, 1050 સેન્ડલવુડ પાર્કવે પશ્ચિમ
(Cassie Campbell Community Centre, 1050 Sandalwood Pkwy W)
- સેન્ટ્યુરી ગાર્ડન્સ રિક્રિએશન સેન્ટર 340 વોડન સ્ટ્રીટ પૂર્વ
(Century Gardens Recreation Centre, 340 Vodden St E)
- ડેવિડ સુઝુકી સેકન્ડરી સ્કૂલ, 45 ડેવિસેમ ડ્રાઈવ
(David Suzuki Secondary School, 45 Daviselm Dr)
- અર્ન્સક્લિફ રિક્રિએશન સેન્ટર, 44 ઈસ્ટબોર્ન ડ્રાઈવ
(Earnscliffe Recreation Centre, 44 Eastbourne Dr)
- ગોર મેડોઝ કમ્યુનિટી સેન્ટર, 10150 થી ગોર રોડ
(Gore Meadows Community Centre, 10150 The Gore Rd)
- ગ્રીનબ્રિઅર રિક્રિએશન સેન્ટર, 1100 સેન્ટ્રલ પાર્ક ડ્રાઈવ
(Greenbriar Recreation Centre, 1100 Central Park Dr)
- જીમ આર્ચડેકિન રિક્રિએશન સેન્ટર, 292 કોનેસ્ટોગા ડ્રાઈવ
(Jim Archdekin Recreation Centre, 292 Conestoga Dr)
- સાઉથ ફ્લેચર સ્પોર્ટ્સપ્લેક્સ, 500 રે લોસન બૂલેવર્ડ
(South Fletcher's Sportsplex, 500 Ray Lawson Blvd)

મંગળવારથી ગુરુવાર, ઓક્ટોબર 9-11, સવારે 8:30 થી સાંજે 8

- સિવિક સેન્ટર, 150 સેન્ટ્રલ પાર્ક ડ્રાઈવ
(Civic Centre, 150 Central Park Dr)

-30-

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મીડિયા સંપર્ક :

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા રિલેશન્સ

સીટી ઓફ બ્રામ્પટન

905.874.3654 | natalie.stogdill@brampton.ca